



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦

ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૨/૭/૨૦૧૪ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર
શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી નં.૧૮૯૨/૧૪

કાંઈમબ્રાંચ :

અમદાવાદ શહેરમાં વિસ્તારમાં આગામી રમજાન માસના તહેવાર અનુસંધાને પોલીસ કમિશ્નર શ્રી શિવાનંદ ઝા સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ તેમજ મિલકત સંબંધી ગુન્હાઓ શોધવા સારુ સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ નાયબ પોલીસ કમિશ્નરશ્રી હિમાંશુ શુક્લા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી કે.એન.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. શ્રી આર.બી.રાણા તથા પો.સ.ઈ. શ્રી જે.એન.ઝાલા તથા પો.સ.ઈ. શ્રી એચ.પી.કરેશનાઓ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા આ વખતે રાયખડ ચાર રસ્તા આઈ.પી.મીશન સ્કુલ પાસેથી પો.કો.મહેતાબજી લક્ષ્મણજી નાઓએ આપેલ બાતમી હકિકત આધારે “ સાબરમતી પોલીસ સ્ટેશન I ગુ.ર.નં.૧૨૦/૨૦૧૩ I.P.C.કલમ ૩૫૪, ૧૧૪ મુજબના ગુન્હાના કામે ચોરીએ ગયેલ મુદ્દામાલના ચાંદીના સાંકળા જોડ-૧ કિ.ગ્રા.૧૫,૦૦૦/- તથા ચાંદીના સિક્કા નંગ-૦૩ કિ.ગ્રા.૧૫,૦૦/ અને ચોરીઓ કરવામાં ઉપયોગ કરેલ હોન્ડા શાઈન મોટર સાયકલ કિ.ગ્રા.૩૫,૦૦૦/ સાથે મળી કુલ રૂ.૫૧,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી નટવર ઉર્ફે નટુ S/o ભવાનજી ઠાકોર ઉવ.૨૭ રહે.પાલડી ગામ, ઠાકોર વાસ, વીમા યોજનાના દવાખાના પાસે, મંજુલાબા ગાર્ડન પાસે, એલિસબ્રિજ અમદાવાદ તથા ગામ મારુસણા તા.દેત્રોજ જી.અમદાવાદનાને ઝડપી લઈ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૧/૦૭/૨૦૧૪ ના કલાકઃ ૨૦/૩૦ વાગે પકડી અટક કરવામાં આવેલ છે. આરોપીની ઘનિષ્ટ પુષ્પરછ દરમ્યાંન તેના સાગરીતો સાથે મળી ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હા આચરેલ જેમાં સરખેજ વિસ્તારના હાઈકોર્ટ વસાહતમાં તથા કલોલમાં આવેલ ગાર્ડન સોસાયટીના બે બંધ મકનમાંથી ચોરી કરેલ હોવાનું તથા ભોપલ વિસ્તારમાં બે તથા ચાંદખેડા વિસ્તારમાં બે તથા હિમતનગર ટાઉન વિસ્તારમાં બે મળી કુલ-૯ ઘરફોડ ચોરીના ગુન્હાઓ આચરી એમ કુલ-૧૦ ગુન્હાઓમાં આજદીન સુધી નાશતો-ફરતો રહેલ હોવાનું કબુલાત કરેલ છે. સદરી આરોપીની ઘનિષ્ટ પુષ્પરછ ચાલુ છે અને વધુ ગુન્હાઓ શોધાય તેવી શક્યતા જણાઈ રહેલ છે.

વટવા પો.સ્ટે. :-

વટવા પોસ્ટે ફ.ગુ.ર.નં.૨૧૩/૧૪ ધી.ઇ.પી.કો.કલમ ૪૫૭. ૩૮૦, ૧૧૪ મુજબના કામના આરોપીઓ (૧)કૌસિકભાઈ રતિલાલભાઈ વસાવા ઉવ-૨૧ રહે- ૨૧ ઇન્દિરાનગર શાહવાડી ગામ એમ,જી,ટેક્સટાઇલ્સ ની સામે અ'વાદ શહેર તથા (૨) મેલાભાઈ કાળુભાઈ ઠાકોર ઉવ-૩૬ રહે- શ્રીજી રો હાઉસમા કમ્પાઉન્ડ મા શાહવાડી ટીકુ ફેક્ટરી જુનાઓકટ્રોય નાકા પાસે અ'વાદ શહેર તથા (૩) મહમદ અશરફ રમજાની શેખ ઉવ-૬૫ રહે- મ.નં.૨ મહેર રો હાઉસ ફેસલ પાર્ક ની સામે બોમ્બે હોટલની પાસે દાણીલીમડા અ'વાદ શહેર નાઓને કીમ સ્કાય બ્લ્યુ લાઇટ ગ્રે કલરના કોટનની ૨૧૪ પેન્ટો તથા તથા બ્લેક કલરના કોટનની ૧૮૮ પેટો તથા વાદળી કલરના કોટનની ૧૨ પેટો તથા ખાખી કલરના કોટનની ૬૩ પેટો તથા બ્લેક કીમ કોફી કલરના કોટનની ૩૮ પેટોની ગણી કુલ ૫૧૬ પેટે ની સાથે એક પેટની કી.રૂ. ૩૫૦ લેખે કુલ્લે કી.રૂ. ૧,૮૦,૬૦૦ ના મુદામાલ સાથે અત્રેના સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ શ્રી જે.બી.બુબડીયા નાઓએ તા.૨૧.૭.૧૪ ના કલાક ૧૮.૩૦ વાગે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે હાલમાં તપાસ ચાલુ છે.

મહિલા પોલીસ સ્ટેશન :-

તારીખ 19/07/2014 ના સવારના સમયે પોલીસ હાટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર મુસ્કાન બહેન (નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો અને મુસ્કાન બહેને જણાવેલ કે મારે મારા પાડોશી ખુશ્બુબહેન સાથે પાણી ભરવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ છે તો મને મદદ કરશો. તો પોલીસ હાટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ વટવા પોલીસ સ્ટેશન વિસ્તારની PCR વાન સ્થળ પર મોકલી મદદ પહોંચાડી હતી.અને મુસ્કાન બહેન સાથે અનઈચ્છનીય ઘટના બનતા અટકાવેલ.

તારીખ 18/07/2014 ના બપોરના સમયે પોલીસ હાટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રીટા બહેન (નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો અને રીટા બહેને જણાવેલ કે તેમના દોઢ વર્ષના દીકરાને તેના સાસરીવાળા લઇ ગયેલા છે અને તેમને મારીને કાઢી મુકેલ છે તો મને મદદ કરશો. તેઓને સામેવાળા સાથે સામાન્ય બોલાચાલી ઝઘડો થયેલ છે. તો પોલીસ હાટ 1091 ઉપરની ઓપરેટરે બાબતની ગંભીરતાને સમજતા તરત જ રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારની PCR વાન સ્થળ પર મોકલી આપી રીટા બહેનની મદદ કરી બંને વચ્ચે શાંતિ પૂર્વક સમાધાન કરાવેલ.

તારીખ 18/07/2014 ના રોજ સવારે પોલીસ હાટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર શ્વેતા બહેન (નામ બદલેલ છે) નો ફોન આવ્યો અને જણાવેલ કે મારા કાકાજી મકાન બાબતે મારી સાથે ઝઘડો કરે છે અને મારા કપડા ફાડી દીધેલ છે. તેઓની વચ્ચે બાપદાદાના મકાન માં કોર્ટ કેસ ચાલતો હોવા છતાં સમારકામ કરાવતા હોઈ બોલાચાલી ઝઘડો થયેલ છે મદદ કરશો. જેથી પોલીસ હાટ 1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની PCR વાન સ્થળ પર મોકલીને પ્રીતિ બહેનને મારતા બચાવી અનઈચ્છનીય ઘટના બનતા અટકાવેલ..

તારીખ 17/07/2014 ના રોજ સવારે પોલીસ હાટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર નિપા બહેન (નામ બદલેલ છે)નો ફોન આવ્યો અને જણાવેલ કે તેમની બાજુમાં રહેતા સુમિત્રાબહેન સાથે પાણી બાબતે ઝઘડો કરે છે તો મદદ કરશો. જેથી પોલીસ હાટ 1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની PCR વાન સ્થળ પર મોકલી આપી નીપા બહેન ને મદદ કરી તેમના પાડોશી સુમિત્રા બહેન વિરુદ્ધ લેખિત માં અરજી આપેલ છે અને નિપા બહેન સાથે કોઈ અનઈચ્છનીય ઘટના બનતા અટકાવેલ.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.